# ALOK INDUSTRIES LIMITED





16th April, 2022

**BSE Limited** 

Phiroze Jeejeebhoy Towers, Dalal Street, Mumbai - 400 001

Scrip Code: 521070

**National Stock Exchange of India Limited** 

Exchange Plaza, Plot No. C/1, G Block, Bandra-Kurla Complex,

Bandra (East), Mumbai - 400 051

Symbol: **ALOKINDS** 

Dear Sir/Madam,

Sub: Newspaper Publication - Audited Financial Results for the quarter / year

ended 31st March, 2022.

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed herewith copies of the newspaper publication for the Audited Financial Results (Consolidated & Standalone) for the quarter / year ended 31<sup>st</sup> March, 2022 published in Business Standard (English) and Lokmitra (Gujarati) newspapers today, i.e. 16<sup>th</sup> April, 2022.

Kindly take record of the same.

Thanking you.

Yours faithfully,

For Alok Industries Limited

Hitesh Kanani

ana

Company Secretary & Compliance Officer

Membership No. F6188

Encl: As Above

Notice is hereby given for investigation of title of the property described in the schedule written herein below. In case if anybody is having any claims, rights, title, interest of any nature whatsoever in any capacity whatsoever in, over or upon the property described in he Schedule written herein below or any portion thereof, then the same must be intimate in writing supported by authenticated photocopies of valid or effectual documentary prototo the undersigned within 14 days from the date of publication hereof. Failing which, it sha be presumed that nobody has any claims or rights of whatsoever nature upon the propert described in at nobody has any claims or rights of whatsoever nature upon the property described in the Schedule written hereunder. Further, with such presumption the title of the owners to the property shall be certified accordingly.

Schedule (Description of Property)

All that piece and parcel of the agricultural land lying, being & situated at Village MOHILI

TARFE VASRE, Tal. Karjat, Dist. Raigad bearing-					
Owner	Survey No.	Hiss No.	Area (H.Aar)	Assessment (Rs.P.)	
Mr. Dattu Waghu Gharat	7	2	00-98-90	17-87	
Dated 26th Day of March, 2022  Adv. Deepak Govind Botungale, Off. Add.: Shop No.04, Janaki Niwa, Opp. Pinto Gas, Vitthal Nagar, Tal-Karjat, Dist. Raigad-410201. Contact No. +91-8888400282					

**PUBLIC NOTICE** 

Notice is hereby given for investigation of title of the property described in the schedule written herein below. In case if anybody is having any claims, rights, title, interest of any nature whatsoever in any capacity whatsoever in, over or upon the property described in he Schedule written herein below or any portion thereof, then the same must be intimated n writing supported by authenticated photocopies of valid or effectual documentary proc to the undersigned within 14 days from the date of publication hereof. Failing which, it shall be presumed that nobody has any claims or rights of whatsoever nature upon the property described in the Schedule written hereunder. Further, with such presumption the title of he owners to the property shall be certified accordingly.

Schedule (Description of Property)

All that piece and parcel of the agricultural land lying, being & situated at Village BEED BUDRUK, Tal. Karjat, Dist. Raigad bearing-

Owner	Survey No.	Hiss No.	Area (H.Aar)	Assessment (Rs.P.)	
Mr. Gangaram Balu Lobhi	7	3	00-13-00	2-19	
Dated 26th Day of March, 2022 പ്ര	Adv. Deepak Govind Botungale, Off. Add.: Shop No.04, Janaki Niwa, Opp. Pinto Gas, Vitthal Nagar, Tal-Karjat, Dist. Raigad-410201. Contact No. +91-8888400282				

**PUBLIC NOTICE** 

Notice is hereby given for investigation of title of the property described in the schedule written herein below. In case if anybody is having any claims, rights, title, interest of any nature whatsoever in any capacity whatsoever in, over or upon the property described in the Schedule written herein below or any portion thereof, then the same must be intimate in writing supported by authenticated photocopies of valid or effectual documentary proc to the undersigned within 14 days from the date of publication hereof. Failing which, it sha be presumed that nobody has any claims or rights of whatsoever nature upon the property described in the Schedule written hereunder. Further, with such presumption the title of the owners to the property shall be certified accordingly.

Schedule (Description of Property)
All that piece and parcel of the agricultural land lying, being & situated at Village BEED BUDRUK, Tal. Karjat, Dist. Raigad bearing-

Owner	Survey No.	Hiss No.	Area (H.Aar)	Assessment (Rs.P.)
Mr. Sandip Anant Bhoir	7	2	00-15-90	2-81
Dated 26th Day of March, 2022		Off. Add Opp. Pii Tal-Karj	epak Govind B I.: Shop No.04, nto Gas, Vitthal at, Dist. Raigac	Janaki Niwa, Nagar, I-410201.

# PUBLIC NOTICE TO WHOMSOEVER IT MAY CONCERN

This is to inform the General Public that following share certificates of TPL Plastech Limited having its Registered Office at Sabari, 213, Kachigam Daman, Daman & Diu, 396210 registered in the name of the following Shareholder/s have been lost by them

Sr.	Name of the	Folio	Certificate	Distinctive	No of
No	Shareholder/s	No	No./s	Number/s	Shares
1.	Deviben P Shah	0000329	7264	5859201-5859300	100
	Vinod G Shah				
2.	Parasmal C Shah	0000328	7263	5859101-5859200	100
	Deviben P Shah				

The Public are hereby cautioned against purchasing or dealing in any wa with the abovereferredsharecertificates.

Any person who has any claim in respect of the said share certificate/s should lodge such claim with the Company or its Registrar and Transfe Agents Link Intime India Private Limited 247 Park, C-101, 1st Floor L. B. S. Marg, Vikroli (W), Mumbai - 400083, TEL: 022 49186270 within 15 days of publication of this notice after which no claim will be entertained and the Company shall proceed to issue Duplicate Share Certificate/s.

Deviben P Shah, Vinod G Shah Place: Mumbai Date: 16.04.2022 Parasmal C Shah, Deviben P Shah

#### **PUBLIC NOTICE** Notice is hereby given for investigation of title of the property described in

the schedule written herein below. In case if anybody is having any claims rights, title, interest of any nature whatsoever in any capacity whatsoever n, over or upon the property described in the Schedule written herein below or any portion thereof, then the same must be intimated in writing supported by authenticated photocopies of valid or effectual documentary ithin 14 days from the date o ndersigned v nereof. Failing which, it shall be presumed that nobody has any claims or rights of whatsoever nature upon the property described in the Schedule written hereunder. Further, with such presumption the title of the owners to the property shall be certified accordingly

Schedule (Description of Property) All that piece and parcel of the agricultural land lying, being & situated at Village MOHILI TARFE VASRE, Tal. Karjat, Dist. Raigad bearing-

Owner	No.	No.	Area (H.Aar)	(Rs.P.)	
Mr. Vasant Gharat	12	1A	00-40-00 out of 01-35-10	3-14	
Mr. Mahendra Gharat	12	1A	00-50-00 out of 01-35-10	4-18	
Gaurav Thakre through L.R.Shevanta Thakre	12	1A	00-45-10 out of 01-35-10	3-68	
Dated 14th Day of January, 2022 Adv. Deepak Govind Botungale Off. Add.: Shop No.04, Janaki Niwa, Opp. Pinto Gas, Vitthal Nagar, Tal-Karjat, Dist. Raigad-410201. Contact No. +91-8888400282					

IN THE BOMBAY CITY CIVIL COURT AT BOMBAY **MENTAL HEALTH PETITION NO.48 OF 2022** 

> In matter of Guardianship of a mental disabled person i.e. Mr. Shakir Abdu Karim Merchant who is the son o Petitioner no 1 and brother of petitioner No 2

> And In the matter of Mental Health care Ac 2017 and right of person with disabilities Act 2016

> In the matter of appointment o guardian of a male Mr. Shakir Abdul Karim Merchant (Mentally retardation), presently in custody o Mrs. Khairunissa Abdul Karim Merchant residing at : B/12, Abubaka Mahal, 64th Dadabhai road, Opp HDFC Bank, Andheri (West), Mumba 400058 without remuneration as per the provisions of Mental Health care Act 2017

Mrs. Khairunissa Abdul Karim Merchant aged 70 years residing at : B/12, Abubakar Mahal, 64th Dadabhai road, Opp. HDFC Bank, Andheri (West). Mumbai - 4000058

...Petitioner No 1

Mr. Afzal Abdul Karim Umer Merchant S/o late Father Abdul Karim Umer Merchant residing at : B/12, Abubaka Mahal, 64th Dadabhai road, Opp. HDFC Bank, Andheri (West), Mumbai 4000058

...Petitioner No 2

Notice is hereby given that the Petitioner above named has filed the above mentioned petition for being appointed as the guardian of Mr. Shakir Abdul Karim Merchant (Mentally retardation) and also need to take all the decision on his behalf by the petitioner above named. Any party having any objection thereto should inform to undersigned in writing before the Hon'ble Judge Shri G.B. Gurao in Court Room No. 17th on before 05/05/2022 with reasons justifying the same after which such objection if any be deemed to have been waived. Given under hand and seal of this court.

Additional Registra City Civil Court, Mumbai

Dated: 13/04/2022

#### **PUBLIC NOTICE**

Notice is hereby given to the public by and large that I am instructed by my client M/s Chaitanya Builders & **Developers,** through its Proprietor, Shri. Rajendra Madhukar Joshi, to investigate leasehold rights, title and interest of M/s Chaitanya Builders & Developers, through its Proprietor, Shri. Rajendro Madhukar Joshi and M/s. Devinfra Builders and Developers LLP through its Partners Shri. Laxmi Sanjay Metkari, Shri. Tushar Dilip Suryavanshi and Shri. Krishnaraj Dileep Mane with respect to plot of land bearing Plot No. 258, Sector R3, area admeasuring about 700 sq.mtrs, Village : Vadghar, Node Pushpak, Taluka : Panvel and District

ALL PERSONS having any claim to or any share, right, title and interest against or to the Said Property by way of sale, transfer, assignment, mortgage, lien, lease, trust, gift, charge, easement possession, inheritance, maintenance or otherwise howsoever are hereby required to make the same known to the undersigned in writing, at my office address mentioned below within 15 days from the date of publication hereof, alongwith documentary proof in support of such claim, failing which I shall certify the leasehold rights of **M/s. Chaitanya** Builders & Developers, through its Proprietor, Shri. Rajendra Madhukar Joshi and M/s. Devinfra Builders and **Developers LLP**, through its Partners Shri, Laxmi Saniav Metkari, Shri, Tushar Dilip Suryavanshi and Shri. Krishnaraj Dileep Mane, to the said property without naving any reference to such claim, if any, and the same shall be deemed/considered to have been waived and/or given up.

THE SAID PROPERTY ABOVE REFERRED TO: ALL THAT piece and parcel of plot of land bearing Plot No. 258, Sector R3, area admeasuring about **700 sq.mtrs.** Village : Vadghar, Node : Pushpak Taluka: Panvel and District: Raigarh Dated this 16th Day of April 2022

> Sd/-Shraddha Pandey Advocate

301, The Landmark, Plot No - 26A, Sector 7. Kharahar, Navi Mumbai. Maharashtra 410210

**PUBLIC NOTICE** 

Notice is hereby given for investigation of title of the property described in the schedule written herein below. In case if anybody is having any claims, rights, title, interest of any nature whatsoever in any capacity whatsoever in, over or upon the property described in the Schedule written herein below or any portion thereof, then the same must be intimate in writing supported by authenticated photocopies of valid or effectual documentary prod to the undersigned within 14 days from the date of publication hereof. Falling which, it shall be presumed that nobody has any claims or rights of whatsoever nature upon the property described in the Schedule written hereunder. Further, with such presumption the title of the owners to the property shall be certified accordingly.

Schedule (Description of Property)

All that piece and parcel of the agricultural land lying, being & situated at Village MOHILI TARFE VASRE, Tal. Karjat, Dist. Raigad bearing-

Triti E Violes, fair taljas, Diot talgas boaring					
Owner	Survey No.	Hiss No.	Area (H.Aar)	Assessment (Rs.P.)	
Mr. Akshay Kashinath Patil	8	2	00-31-10	4-87	
Dated 23rd Day of February, 2022		Off. Add Opp. Pii Tal-Karj	epak Govind B I.: Shop No.04, nto Gas, Vitthal at, Dist. Raigac No. +91-88884	Janaki Niwa, Nagar, I-410201.	

केनरा बैंक Canara Bank 📣 ीं सिंडिकेट Syndicate

DP Code: 0299

## **POSSESSION NOTICE [SECTION 13(4)]**

(For Immovable property) Whereas:

The undersigned being the Authorised Officer of the Canara Bank under Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act 54 of 2002) (hereinafter referred to as "the Act") and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice dated 28/08/2021 calling upon the borrower Mr. Nitin Ramraoji Dhotare to repay the amount mentioned in the notice, being Rs.10,17,137.64 (Rupees Ten Lakh Seventeen Thousand One Hundred and Thirty Seven and Sixty Four Paise Only) within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him / her under section 13(4) of the said Act, read with Rule 8 & 9 of the said Rule on this 11th day of April of the year 2022.


The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of Canara Bank for an amount of Rs.10,17,137.64 and interest thereon.

The borrower's attention is invited to the provisions of Section 13(8) of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the Immovable Property

Flat No. C-103 Survey No. 1091/1 Nashik Police Co-Op Housing Society, Adagaon, Nashik Bounded as East: S. No. 1903, West: Shiv Road, North: S. No. 1103, South: Part of S. No. 1091/1

Date: 11/04/2022 Place: NASHIK ROAD BRANCH



Sd/-Authorised Officer, Canara Bank

0 **ALOK** 

## ALOK INDUSTRIES LIMITED

CIN. L17110DN1986PLC000334

Regd Office: 17/5/1, 521/1 Village Rakholi / Sayli, Silvassa - 396230 Union Territory of Dadra and Nagar Haveli.

Tel No.: 0260-6637000; Fax No.: 0260-2645289 Email Id.: investor.relations@alokind.com; Website: www.alokind.com **Extract of Audited Consolidated Financial Results** 

	for the Year Ended 31st March, 2022								
		(₹ in Crore, exce	pt per share data						
Sr. No.	Particulars	Year Ended 31.03.2022	Year Ended 31.03.2021						
1	Revenue from Operations	7,309.50	3,847.59						
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional items)	(209.42)	(562.18)						
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional items) *	(209.42)	(4,454.23)						
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)	(208.60)	(5,673.32)						
5	Total Comprehensive Income for the period after tax	(250.55)	(5,624.28)						
6	Paid up Equity Share Capital, Equity Shares of ₹ 1/- each	496.53	496.53						
7	Other Equity excluding revaluation reserve**	(18,403.84)	(18,153.28)						
8	Earnings per equity share (EPS)								
	(Face value of ₹1/- each) (Not annualised) :								
	Basic (in ₹ ) after exceptional items	(0.42)	(15.19)						
	Basic (in ₹ ) before exceptional items	(0.42)	(4.77)						
	Diluted (in ₹) after exceptional items	(0.42)	(15.19)						
	Diluted (in ₹) before exceptional items	(0.42)	(4.77)						

\* Includes Non-Controlling Interest

\* Reserve excluding revaluation reserves for the year ended as on 31st March, 2022 was ₹ (18,403.84)

The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above

results and its release at their respective meetings held on 14th April, 2022. Additional information on Audited Standalone Financial Results is as follows

r. o.	Particulare	Year Ended 31.03.2022	Year Ended 31.03.2021
	Revenue from Operations	7,150.91	3,735.31
i	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional item)	(184.18)	(1,190.78)
ii	Net Profit / (Loss) for the period after tax (after Exceptional item)	(184.18)	(5,854.99)
v	Total Comprehensive Income for the period (after tax)	(184.68)	(5,852.14)

The above is an extract of the detailed format of the Standalone and Consolidated Audited Financial Results for the year ended on 31st March, 2022 filed with the Stock Exchanges pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results for the year ended on 31st March, 2022 are available on the Stock Exchanges' websites (www.bseindia.com /www.nseindia.com) and the Company's website www.alokind.com

For Alok Industries Limited

(₹ in Crore)

Sd/-Place : Mumbai A. Siddharth : 14th April, 2022 Chairman

National Business Centre, **Zonal Office Mumba J&K** Bank 1st & 2nd Floor, Bandra Kurla Complex Bandra (E) Mumbai- 400051

Mr. Amirchand Rikhiram Khajuria, Proprietor of M/s. Amir Khajuria, Carrying on its

business at Shop No.1 & 2, Ground Floor, Angad Villa CHSL, Navghar Road, Nea Mother Mary School, Kasturi Park, Bhayander East, Dist. Thane - 401105 (Borrower-Mortgagor). Mr. Ashwini Kumar B. Chaubey S/o. Mr.Bans Naraya Chaubey, R/o. Flat No.306, Dwarka Palace, Bhayander East, Dist. Thane – 40110 Sub: Notice under Section 13(2) of Securitization and Reconstruction of

Financial Assets & Enforcement of Security Interest Act, 2002

This Demand Notice under Section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafte referred to as "The Act") is issued by me Arshad Nazir on this day of April 2022 a Authorized Officer of Jammu and Kashmir Bank Ltd duly empowered in accordance with the provisions of SARFAESI Act, 2002 for the reasons stated hereinafter: Whereas, Business unit, Mira Road Thane of Jammu and Kashmir Ban

hereinafter called Bank) sanctioned various credit facilities details whereof is: a) A Secured Overdraft Facility of Rs.12.00 Lacs vide sanctioned Ref. No MR/SOD/2012- dated 28.12.2012 to you (herein after also referred as borrower Whereas above said credit facility was secured by following securities:

Primary Security: Mortgage of Shop No.1 & 2, Ground Floor, Angad Villa CHSL Navghar Road, Near Mother Mary School, Kasturi Park, Bhayander East, Dist hane – 401105; constructed on land bearing Sub-divided Plot No.23, Old Survey No.174, New Survey No.45, H. NO.10, admeasuring 460 sq.yds. equivalent to 410 sq. mtrs or thereabouts situate, lying and being at Village Khari and Taluka Thane i the registration Sub-District of Thane Third party guarantee of One person namely Mr. Ashwini Kumar B. Chaubey S/o. Mr. Bans Narayan Chaubey R/o. Flat No.306 Dwarka Palace, Bhayander East, Dist, Thane – 401105.

Whereas the above said credit facilities were availed by you as borrower afte creation of security interest in the above referred properties (secured Assets) in your of the Bank, Whereas, borrower has failed to maintain the credit facility as p terms and conditions of the above referred sanction letter/s and other terms and conditions laid down in the documents executed by borrower in favour of the Bank consequently borrower loan account No.0364030100000102 has been classified by the Bank as Non-Performing Asset on 31.03.2021 in accordance with the directives and guidelines of the Reserve Bank of India. The details of loan account

S.	Facility	Sanctioned	Limit	Date	Amount	Interest	Total
No.	-	Limit	Availed	of NPA	of NPA	upto	outstanding as
						28.02.2022	on 28.02.2022
1.	Housing	12.00	12.00	31.03.	12,45,567	2,63,554.02	15,09,121.29
	Loan	Lakh	Lakh	2021	27		
	Facility						
1	In addition to account autotanding on an OC OC OCO. Book on account and then						

In addition to amount outstanding as on 28.02.2022, Bank, as secured credito reserves the right to claim amount which may become due on account of crystallization of BG's and/or devolvement of LC's (if any) Total outstanding as on 28.02.2022 is Rs. 15.09.121.29

Whereas the above said amount is due and payable from you as borrower in the books of accounts of the Bank.

Now since borrower has failed and neglected to make payment of dues in respect c the said Loan duly secured by the securities mentioned hereinabove, and classification of borrowers account as a Non-Performing Asset, I above named as Authorized Officer in exercise of the powers vested in me under the provisions of SARFAESI Act, 2002 and rules made there under hereby give borrower notice under sub-section (2) of section 13 of Securities and Reconstruction of Financia Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon borrower to pay in full and discharge borrower liabilities aggregating to Rs. 15,09,121.29 (Rupees Fifteen Lacs Nine Thousand One Hundred Twenty One and paise Twent Nine only) as stated herein above, together with interest at contractual rate thereor w. e. f. 01.03.2022 along with other charges and costs to be incurred by the Ban from time to time and thereby discharge in full all borrowers liabilities to the Bank within a period of 60 days from the date of this Notice failing which the Bank shall at borrowers costs and risk exercise its powers under the Act .

We further give borrower notice that in case of failure to pay the above mentioned outstanding amount with interest and costs till the date of payment within the stipulated period of 60 days, we shall be free to exercise all or any of the rights under sub-section (4) of section 13 of the said Act and;

) In the event of borrower's failure to pay amount as demanded, Bank is authorized under the Act to take possession, control and or management of the above mentioned secured asset together with the right to transfer by way of lease assignment or sale, without the intervention of the court.

ii) All expenses incurred in the process shall be debited to borrower account and wil be recovered from borrower. Moreover in the event of sale of the secured asset borrower liability is not discharged in full, Bank shall have right to recover th remaining balance from borrower.

iii) This demand notice is without prejudice to and shall not be construed as waiver of any other rights or remedies which Bank may have including the right to make further demands in respect of sums owing to Bank.

iv) Section 13(13) of the Act restrains borrower/mortgagor after the date of this notice from transferring by way of sale, lease or otherwise any of secured asset eferred to in this notice, without prior written consent of the Bank and breach of the said provision is an offence punishable under Section 29 of the Act.

v) This demand notice is recall of the loan amount and demand by the secured creditor of the outstanding amount without prejudice to the rights of the Bank to proceed as against the borrower / company / Directors / mortgagors / guarantors for initiating recovery proceedings under any other legal remedies

vi) Borrower is also informed that it can redeem the secured asset within the time frame prescribed by section 13(8) of the Act.

Sd/- Arshad Nazir **Authorised Office** 



**National Business Centre** Zonal Office Mumba 1st & 2nd Floor, Bandra Kurla Complex Bandra (E) Mumbai- 40005

Ref. No: JKB Dated: 05.04.202 Mrs.Shaheen Raies Khan W/o.Mr.Raies Khan & Mr.Raies L. Khan S/o.Mr.Liyaka Khan, Both Residing at Flat No.303 & 304, 3rd floor, Bldg No.B-2, Bldg Noopu Nagar, Sheetal Nagar, Mira Road East, Dist Thane 401107. (Borrower-Mortgagor). Mr. Anil Kumar Chandrapal Agarwal R/o. 25/705-706. Shanti Niketan CHS Chatrapati Shivaji Raje Complex, New Link Road, Kandiwali (West), Mumbai -400 067 Guarantor). Mr. Rashid Magsood Khan S/o.Magsood Khan, R/o.B/2, Flat No 203, Nupoor Nagar, Sheetal Nagar, Mira Road East, Dist Thane 401107 (Guaranto

Sub: Notice under Section 13(2) of Securitization and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002

Dear Sir/s This Demand Notice under Section 13 (2) of the Securitization and Reconstructio of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafted) eferred to as "The Act") is issued by me Arshad Nazir on this day of April 2022 as Authorized Officer of Jammu and Kashmir Bank Ltd duly empowered in accordan rith the provisions of SARFAESIAct, 2002 for the reasons stated hereinafter

Whereas, Business unit, Mira Road Thane of Jammu and Kashmir Bar hereinafter called Bank) sanctioned various credit facilities details whereof is: a) A Housing Loan Facility of Rs.4.00 Lacs vide sanctioned Ref. No.MR/2006- date 02.02.2006 to you (herein after also referred as borrower)

Whereas above said credit facility was secured by following securities: Primary Security: Mortgage of Flat No.303 & 304, 3rd floor, Bldg No.B-2, Bldg Noopur Nagar, Sheetal Nagar, Mira Road East, Dist Thane 401107; constructed o and bearing Survey No.482 (part), situate at Revenue Village Bhayander, Near Mir Road Railway Station and within the limits of Original Bhayander (Navghar Villag Group) Gram Panchayat and now the Mira Bhayander Nagar Parishad and in the egistration District and sub-district of Thane, situated at Sheetal Nagar, Mira Roa East), District Thane Third party guarantee of two persons namely Mr. Anil Kuma Chandrapal Agarwal R/o. 25/705-706, Shanti Niketan CHSL, Chatrapati Shiva Raje Complex, New Link Road, Kandiwali (West), Mumbai -400067. AND Mr Rashid Maqsood Khan S/o.Maqsood Khan R/o.B/2, Flat No.203, Nupoor Nagal Sheetal Nagar, Mira Road East, Dist Thane 401107.

Vhereas the above said credit facilities were availed by you as borrower after creation of security interest in the above referred properties (secured Assets) in favour of the Bank

Whereas, borrower has failed to maintain the credit facility as per terms an conditions of the above referred sanction letter/s and other terms and conditions laid down in the documents executed by borrower in favour of the Bank, consequently horrower loan account No.0364265500000954 has been classified by the Bank a Non-Performing Asset on 31.03.2021 in accordance with the directives and guidelines of the Reserve Bank of India. The details of loan account are as under:

S.	Facility	Sanctioned	Limit	Date	Amount	Interest	Total
No.		Limit	Availed	of NPA	of NPA	upto	outstanding as
						28.02.2022	on 28.02.2022
1.	Housing	4.00	4.00	31.03.	2,46,443.	51,634.00	2,98,077.58
	Loan	Lakh	Lakh	2021	58		
	Facility						

n addition to amount outstanding as on 28.02.2022, Bank, as secured creditor reserves the right to claim amount which may become due on account o crystallization of BG's and/or devolvement of LC's (if any)

Total outstanding as on 28.02.2022 is Rs.2,98,077.58 Whereas the above said amount is due and payable from you as borrower in the oooks of accounts of the Bank.

Now since borrower has failed and neglected to make payment of dues in respect o the said Loan duly secured by the securities mentioned hereinabove, and classification of borrowers account as a Non-Performing Asset. Labove named as Authorized Officer in exercise of the powers vested in me under the provisions of SARFAESI Act, 2002 and rules made there under hereby give borrower notice nder sub-section (2) of section 13 of Securities and Reconstruction of Financia Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon borrower to pay in full and discharge borrower liabilities aggregating to Rs. 2,98,077.58 (Rupee Two Lacs Ninety Eight Thousand OSeventy Seven and paise Fifty Eight only) as stated herein above, together with interest at contractual rate thereon w. e. 01.03.2022 along with other charges and costs to be incurred by the Bank from time to time and thereby discharge in full all borrowers liabilities to the Bank within a period of 60 days from the date of this Notice failing which the Bank shall a orrowers costs and risk exercise its powers under the Act.

We further give borrower notice that in case of failure to pay the above mentioned outstanding amount with interest and costs till the date of payment within the stipulated period of 60 days, we shall be free to exercise all or any of the rights unde sub-section (4) of section 13 of the said Act and:

) In the event of borrower's failure to pay amount as demanded, Bank is authorized inder the Act to take possession, control and or management of the above nentioned secured asset together with the right to transfer by way of lease assignment or sale, without the intervention of the court.

be recovered from borrower. Moreover in the event of sale of the secured asser porrower liability is not discharged in full, Bank shall have right to recover the remaining balance from borrower.

i) All expenses incurred in the process shall be debited to borrower account and wi

ii) This demand notice is without prejudice to and shall not be construed as waiver o my other rights or remedies which Bank may have including the right to make further demands in respect of sums owing to Bank. v) Section 13(13) of the Act restrains borrower/mortgagor after the date of thi

notice from transferring by way of sale, lease or otherwise any of secured assets eferred to in this notice, without prior written consent of the Bank and breach of the said provision is an offence punishable under Section 29 of the Act. ) This demand notice is recall of the loan amount and demand by the secure

creditor of the outstanding amount without prejudice to the rights of the Bank to

proceed as against the borrower / company / Directors / mortgagors / guarantors for nitiating recovery proceedings under any other legal remedies vi) Borrower is also informed that it can redeem the secured asset within the tim rame prescribed by section 13(8) of the Act.

Sd/- Arshad Nazir Authorised Office



National Business Centre Zonal Office Mumba 1st & 2nd Floor, Bandra Kurla Complex Bandra (E) Mumbai- 400051 Dated: 05.04.202

Mr. Sanjay Yadav S/o Mr.Ramraj Yadav, R/o Flat No. 20(504), 5th Floor, in the ociety, Known as Charkop Rakesh CHS Ltd, Dr. Babasaheb Ambedkar Road, CTS Nos.IC-1/198, Plot No.215/RDP-5, Sector-III, Charkop, Kandivali West, Mumbai 400067. (Borrower-Mortgagor). **Mrs.Ranjana Sanjay Yadav** W/o.Mr.Sanjay Yadav, R/o Flat No. 20(504), 5th Floor, in the society Known as Charkop Rakesh CHS Ltd Or. Babasaheb Ambedkar Road, CTS Nos.IC-1/198, Plot No.215/RDP-5, Sector-II

Charkop, Kandivali West, Mumbai – 400067. (Guarantor) Sub: Notice under Section 13(2) of Securitization and Reconstruction of Financial Assets & Enforcement of Security Interest Act, 2002 Dear Sir/s,

This Demand Notice under Section 13 (2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafted) eferred to as "The Act") is issued by me Arshad Nazir on this day of April 2022 as Authorized Officer of Jammu and Kashmir Bank Ltd duly empowered in accordance vith the provisions of SARFAESIAct, 2002 for the reasons stated hereinafter

Whereas, Business unit, Mira Road Thane of Jammu and Kashmir Ban hereinafter called Bank) sanctioned various credit facilities details whereof is: a) A Housing Loan Facility of Rs. 60.00 Lacs vide sanctioned Re-No.JKB/MIRA/HL/07/2017-0364304 dated 19.08.2017.

to you (herein after also referred as borrower). Vhereas above said credit facility was secured by following securities:

remises being Flat No.20 (504) admeasuring 526 Sq.ft. (48.87 Sq.Mtrs.) Built up rea on the 5 th floor, in the society known as "CHARKOP RAKESH CHS. LTD. Situated at Dr.Babasaheb Ambedkar Road, Charkop, Kandivali West, Mumbai 400067; constructed on land bearing bearing CTS Nos.IC-1/198, Plot No.215/RDP Sector – III, Village Kandivali, Taluka Borivali, Mumbai Suburban District Third

Primary Security: Equitable Mortgage of all piece and parcel of residentia

arty guarantee of One person namely Mrs.Ranjana Sanjay Yadav W/o.Mr.Sanjay /adav, R/o. Flat No.20 (504) admeasuring 526 Sq.ft. (48.87 Sq.Mtrs.) Built up area on the 5th floor, in the society known as "CHARKOP RAKESH CHS. LTD. Situated a Dr.Babasaheb Ambedkar Road, Charkop, Kandivali West, Mumbai –400067.

Whereas the above said credit facilities were availed by you as borrower after creation of security interest in the above referred properties (secured Assets) in favour of the Bank.

Whereas, borrower has failed to maintain the credit facility as per terms an onditions of the above referred sanction letter/s and other terms and conditions laid down in the documents executed by borrower in favour of the Bank, consequent borrower loan account No.0364265500001522 has been classified by the Bank a Non-Performing Asset on 31.03.2021 in accordance with the directives and guidelines of the Reserve Bank of India. The details of loan account are as under:

S.	Facility	Sanctioned	Limit	Date	Amount	Interest	Total
No.	-	Limit	Availed	of NPA	of NPA	upto	outstanding as
						28.02.2022	on 28.02.2022
1.	Housing	60.00	60.00	31.03.	55,94,677	6,11,152.93	62,05,830.42
	Loan	Lakh	Lakh	2021	49		
	Facility						

In addition to amount outstanding as on 28.02.2022, Bank, as secured creditor reserves the right to claim amount which may become due on account o crystallization of BG's and/or devolvement of LC's (if any) Total outstanding as on 28.02.2022 is Rs. 62.05.830.42

Whereas the above said amount is due and payable from you as borrower in the books of accounts of the Bank.

Now since borrower has failed and neglected to make payment of dues in respect o the said Loan duly secured by the securities mentioned hereinabove, and classification of borrowers account as a Non-Performing Asset, I above named as Authorized Officer in exercise of the powers vested in me under the provisions of SARFAESI Act, 2002 and rules made there under hereby give borrower notice under sub-section (2) of section 13 of Securities and Reconstruction of Financia Assets and Enforcement of Security Interest Act, 2002, and call upon borrower t pay in full and discharge borrower liabilities aggregating to Rs.62,05,830.42 Rupees Sixty Two Lacs FiveThousand Eight Hundred Thirty and paise Forty two only) as stated herein above, together with interest at contractual rate thereon w. e f. 01.03.2022 along with other charges and costs to be incurred by the Bank from time to time and thereby discharge in full all borrowers liabilities to the Bank within a period of 60 days from the date of this Notice failing which the Bank shall at

porrowers costs and risk exercise its powers under the Act We further give borrower notice that in case of failure to pay the above mentioned utstanding amount with interest and costs till the date of payment within the stipulated period of 60 days, we shall be free to exercise all or any of the rights under

sub-section (4) of section 13 of the said Act and; ) In the event of borrower's failure to pay amount as demanded, Bank is authorized under the Act to take possession, control and or management of the above nentioned secured asset together with the right to transfer by way of lease

assignment or sale, without the intervention of the court. ) All expenses incurred in the process shall be debited to borrower account and wil be recovered from borrower. Moreover in the event of sale of the secured asse borrower liability is not discharged in full, Bank shall have right to recover the

emaining balance from borrower. iii) This demand notice is without prejudice to and shall not be construed as waiver of my other rights or remedies which Bank may have including the right to make

urther demands in respect of sums owing to Bank. (v) Section 13(13) of the Act restrains borrower/mortgagor after the date of this otice from transferring by way of sale, lease or otherwise any of secured assets referred to in this notice, without prior written consent of the Bank and breach of the

said provision is an offence punishable under Section 29 of the Act. v) This demand notice is recall of the loan amount and demand by the secured reditor of the outstanding amount without prejudice to the rights of the Bank to proceed as against the borrower / company / Directors / mortgagors / guarantors for

initiating recovery proceedings under any other legal remedies. vi) Borrower is also informed that it can redeem the secured asset within the time frame prescribed by section 13(8) of the Act. Sd/- Arshad Nazir Authorised Officer



seal

























૧૬ એપ્રિલ ૨૦૨૨, શનિવાર

## તંત્રીશ્રીની કલમે

#### સુજલામ સુફલામ જળ અભિયાનની કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ

ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસા જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ ૨૦૧૮થી ઝુંબશરૂપે હાથ ધરવામાં આવ્યું છે. આ ઝુંબેશન ભાગરૂપે ચાલુ વર્ષે ૧૯મી માર્ચથી આણંદ જિલ્લામાં સુજલામ સુકલાય જુળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન અંતર્ગત જિલ્લામાં થયેલા અને કરવામાં આવનાર કામગીરીની સમીક્ષા અર્થે કલેકટ રુલ્લાના વનલા અને કરવાના આવનાર કરનવારા તાલાના એવે કલેકટ કચેરી ખાતે કલેકટર મનોજ દક્ષિણીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. અ બેઠકમાં કલેકટરે નાના-નાના ગામડાંઓની સાથે પાણીની જરૂરિયાતવાળ વિસ્તારોની પાણીની જરૂરિયાતને પર્ણ કરવા સંબંધિત વિસ્તારોમાં તળાવ વસાસના પાકાના કરાવતાન કૂકા કરવા સંગતમાં વસાસના પંચાય ઉંડા કરવા, ચેકડેમના ડિસીલ્ટિંગના કામો, જળાશયના ડિસીલ્ટિંગના કામો નદીઓના કાંસની સાફ્ર-સફાઇ, કેનાલની સફાઇ, ખેત તલાવડી, ચેકડેય રીપેરીંગ જેવા કામો સમયસર શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ બેઠક દરમિયાન સુજલામ સુકલામ જળ અભિયાન અંતર્ગત જિલ્લામાં જુદા જુદા વિભાગ કુંગ્લા હાય ધરવામાં આવતાર ૭૦૦થી વધુ કામો પૈકી કેટલાં કામો શરૂ થયા, કેટલાં કામો પૂરાં થયા, કેટલા કામો પ્રગતિમાં છે તેની વિગતવાર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપનાએ સુજલામ સુકલામ જળ અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર કામો સહિત લોકભાગીદારીથી હાથ ધરવામાં આવના ામોની સમીક્ષા કરી જરૂરી વહીવટી અને તાંત્રિક મંજૂરી સમયસર મેળ લઇને કામો ઝડપથી શરૂ થાય અને પૂરાં થાય તે જોવાનું જણાવી સંબંધિત અધિકારીઓને જળની જાળવણી – જળ સંગ્રહની અગત્યતાને સમજી કામો ના છાલા ૧૫ કરવા ક્ષાપ્યક્રા મૂરાં કરવા સુચવ્યું હતું. આ બેઠકમાં કાર્યપાલક ઇજનેર મનોજ પરમા મહિત સુજલામ સુફલામ જળ અભિયાન સાથે સંકળાયેલ સંબંધિત વિભાગન સાલા છું હતા વ્યુપ્તમાં ૧૦ જાં ભાગમાં વાર્યા માર્યા પ્રાથમિત માર્યા પાયા માર્યા પાયા માર્યા પાયા માર્યા પાયા મ ચાલતી જળ અભિયાનની કામગીરીની સમીક્ષા અર્થે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં આ અભિયાન અંતર્ગત નાના-નાના ગામડાંઓની સાથે પાણીની જરૂરિયાતવાળા વિસ્તારોની પાણીની જરૂરિયાતને પર્ણ કરવ સંબંધિત વિસ્તારોમાં કામો સમયસર શરૂ થાય અને સમય થાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

#### રાજકોટમાં ૧૫૦ ફૂટ રિંગ રોડમાં બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થતા પોલીસે ધરપકડ કરી

રાજકોટ, ફરી એક વાર રાજકોટમાં કાયદો ભંગ કરતા યુવાનો નો વીડિઓ વાઈરલ થતાં પોલીસ એક્શન માં આવી. ૧૫૦ ફટ રિંગ રોડમાં બીઆરટીએસ રૂટ પર ઘોડેસવારી કરતા યુવાનોનો વીડિયો વાઇરલ થયો હતો જેમાં ઘોડા સાથે યુવાનોએ નિયમો નેવે મૂકી ઘોડેસવારી કરતા જોવા મળ્યા હતા. જેને પગલે ગાંધીગ્રામ પોલીસે પ યુવકોની નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતા ધરપકડ કરી છે. હાલ ગાંધીગ્રામ પોલીસે આરોપી રાજ શિયાર, કેતન સોનારા, સુરેશ ડાંગર, જનક ડંબર, અને રાજેશ હુંબલની ધરપકડ કરી છે. જયારે હજુ એક યુવકની ધરપકડ કરવાની બાકી હોય તેવું સામે આવી રહ્યું છે. આ યુવાનોએ ઘોડા ઉપર ઉભા રહી જોખમી કરતબો કરતા પણ વીડિયોમાં કરતા હતા. જેમાં બે તો યુવકો ઘોડા પર ઉભા રહી કરી ઘોડેસવારી કરતા જોવા મળે છે. આ ઘટના ને પગલે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે અને આગળ બીજું કોઈ પણ વ્યક્તિ આવો ગુનો ના કરે તેની પણ તકેદારી રાખવામાં આવશે.

### ખેડા જિલ્લાના ઠાસરામાં પ્રેમીપંખીડા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા, પોલીસે તપાસ નો દૌર શરુ કર્યો

નડિયાદ, ખેડા જિલ્લાના ઠાસરામાં પ્રેમીપંખીડા ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. નગરના દિવ્ય શક્તિ રેસીડેન્સીની સામે રેલવે ટ્રેક નજીક ઝાડી-ઝાંખરામાં વૃક્ષની ડાળી સાથે દુપકા વડે યુવક-યુવતી ગળાકાંત્રો ખાયેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ બંને યુવક?-યુવતી પંચમહાલ જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં પુરાયાના ત્યાં ખેતરમાં મજૂરી કામ કરવા આવ્યા હતા અને એક બીજાના સંપર્કમાં આવ્યા હોવાનું જીવા મળ્યું છે. પોલીસના સુત્રો તરફથી મળતી માહિતી મુજબ મૃતક યુવક જગદીશભાઈ અંધારભાઈ પોરાભાઈ નાયક (ઉમર વર્ષ ૨૧, રહે કાળરીયા તા. ગોધરા જિ.પંચમહાલ) અને યુવતીનું નામ ટીનાબેન પામલભાઈ કલજીભાઈ નાયક (રહે. રણીયાતા તા.ગોધરા ઉંમર વર્ષે ૧૮) હોવાનું જાણવા મળ્યું છે. જો કે બંનેનો આપઘાત કરવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસે આ બંનેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટના ની જાણ સ્થાનિકો દ્વારા ઠાસરા પોલીસને કરતાં પોલીસનો કાકલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પરંતુ રેલ્વે પોલીસની હદ હોવાને કારણે સમગ્ર ઘટના સંદર્ભે રેલ્વે પોલીસને જાણ કરાઇ હતી. બાદ રેલવે પોલીસના કર્મીઓએ ઘટના સ્થળે દોડી જઇ ઓળખને છતી કરવા આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

#### પાટણ શહેર અને જિલ્લામાં આંબેડકર જયંતિની ઉજવણી, રાજકીય પાર્ટીઓએ ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

પાટણ, આઝાદ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિની ઉજવણી પાટણમાં ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ-ભાજપ, આમ આદમી પાર્ટી, ભારત विश्वस परिषद्द सहितना अनस्यित श्राति समाश्रनां विविध संगठनो अने પક્ષોના હોદેદારોએ બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબાસાહેબની પ્રતિમાને ફૂલહાર કર્યા હતાય તેમજ આઝાદ ભારતના બંધારણના ધડવૈયા માટે જબ તક મુરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા જેવા નારાઓ લગાવ્યા હતા. ભારત . દેશના બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિત્તે શહેર વ્યાપ્ત વિવિધ અનુસૂચિત જાતિ સંગઠનો તથા હોદ્દેદારો મોટી સંખ બગવાડા દરવાજા પાસે ઉમટી પડ્યા હતા. તેમજ બાબસાહેબ આંબેડકરની મર્તિને ફલહાર અર્પણ કર્યા હતા. શહેર ભાજપ દ્વારા બંધારણના ઘડવૈયા ડૉ મીમરાવ આંબેડકરના જન્મદિવસ નિમિતે પુષ્પાંજલિ કરવામાં આવી હતી. ા પાતાના ખાના કરાવાલ કાવાના વુષ્પાજાલ કરવામાં આવા હતી. જેમાં જિલ્લા પ્રમુખ દશરાયલ ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેવરી, પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ, પૂર્વ મહામંત્રી કે સી પટેલ, શૈલેષ પટેલ, જ્યેશ ભાઈ પટેલ, મનોજ પટેલ, હેમંત તત્રા, ગૌરવ મોદી, કોર્પોરેટર તથા ભાજપના કાર્યકરી ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ તરા ૧૪મી એપ્રિલ અને હો આહામાં હોલે હતી. લા લાગ્યો જ પ્રદાન હોલે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતી નિમિત્તે બગવાડા દરવાજ ા પાસે સ્થાપિત ભાભા સાહેબની પ્રતિમાને પુષ્પોજીલ કરી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ, પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટિયા, અર્થિન પટેલ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

rinted & Published by Mayur C. Bhatt on behalf of Kr ub. Pvt. Ltd Printed at- Dharti Printers C-3, Sha Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmeda Published from 201-2, Nandan Com. Opp. Mithakha rossing, Mithakhali, Ahd-6 Edi.: Mayur Bhatt

### આજનું રાશિફળ

સ્વાસ્થ્યની બાબતમાં તમારી જાતની અવગણના ન કરવાની સાવચેતી રાખજો. કોઈ નજીક ના મિત્રો થી અમુક વેપારીઓ ને સારું ધન ભ થવા ની શક્યતા છે. આ ધન તમારી ઘણી મુશ્કેલીઓ ને દૂર કરી શકે . પરિવારનું તમામ દેશું તમે ચૂકવી શકશો. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. કામના તત્ત (તત્તા તત્ર્ય સરકાતા જ તત્ત તત્તારા ક્ષુપ્ર સાથ રહેવા તા. કાંગ્યા સ્થળે ઓજે પરિસ્થિતિ તમારી તરફેલમાં જણાય છે. આજે તમે એક નવી પુસ્તક ખરીદી ને અને ઓરડા માં સ્વયં ને બંધ કરી ને આખો દિવસ પસાર કરી શકો છો. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો.

ુપ્રભ ન નમારો ગુસ્સો કોઈકને વધુ મુશ્કેલીમાં મુકી દેશે. આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. નવજાત શિશુની માંદગી તમને વ્યસ્ત રાખશે. તમારે તેના પર તરત ધ્યાન આપવાની જરૂર પડશે. યોગ્ય સલાહ લેજો કેમ કે તમારી બાજુએ જરાક પણ બેદરકારી સમસ્યાને વકરાવી શકે છે. પ્રિયપાત્ર સાથે કેન્ડલ લાઈટમાં ભોજન શેર કરશો. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. આ રાશિ ના જાતકો આજ ના દિવસે પોતાના ભાઈ બહેનો સાથે ઘરે કોઈ મુવી અથવા મેચ જોઈ શકે છે. આવું કરવા થી તમારા લોકો વચ્ચે પ્રેમ વધશે? માત્ર નાનકડા પ્રયાસ્ને કારણે. આજેનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે

મિથુન - તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવ માટે અઢળક સમય મળશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. તમારા પ્રિયપાત્રનું વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્ર માં તમારી અંદર ઉર્જા જોઇ શકાય છે. તમે આપેલા કામ ને સમય સીમા પહેલાજ પૂર્ણ કરી લેશો? તમારે આજે વસ્તુઓ ને બરાબર સમજવા નો પ્રયત્ન કરવો જોઈએ, નહીં તો તમે તમારા કાજલ સમય પર આ બાબતો વિશે વિચારતા રહેશો અને તમારા સમય બગાડશો?. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

કર્ક - ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. આજે તમારા ઓફિસ માં તમારો કોઈ સહકર્યી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સમાન નું ધ્યાન રાખવું જરૂરી છે. તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોને સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે . આજે તમારો મોબાઇલ અથવા ટીવી જોવા પર વ્યર્થ થઈ શકે છે. જીવનસાથી ને તમારી સાથે નારાજ પણ કરશે કારણ કે તમે તેમની સાથે વાત કરવા માં કોઈ રુચિ બતાવશો નહીં. આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે.

વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. જે વેપારી પોતાના વેપાર માટે ઘર થી ભાર

જયી રહ્યા છે તે પોતાના ધન ને ખુબ સાચવી ને રાખે? ધન ચોરી થવા ની શક્યતા છે. તમારા પરિવારના કલ્યાણ માટે સખત મહેનત કરો. તમાર્ગ કાર્ય પ્રેમ અને હકારાત્મક દેષ્ટિકોણથી સંચાલિત હોવું જોઈએ લાલચથી નહીં. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજને દિવસ તમારો છે. તમારામાં થશું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીવદિ આપશે,

તેલા તેલા ભારત વેચનાલાવા કેવાના સાથે છે. જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે. કન્યા - તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. વેપાર માં આજ ના દિવસે સારો લાભ થવા ની શક્યતા છે. આજ ના દિવસે તમે પોતાના વેપાર ને નવી ઉંચાઈઓ આપી શકો છો? ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. તમારા પ્રિયપાત્ર અથવ જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી, તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકે છો. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે

આ ફારવાઠ મૂકા તકા છો. આક તામારા જીવનાલાયા એને તેમારા વેષ્ય ઊંડાશભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે. તુલા - સ્વાસ્થ્યની દષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. પ્રોપર્ટીન . લગતા સોદા સાકાર થશે તથા અકલ્ય લાભ લાવશે. પારિવારિક મોરચે સ્વસ્થત જજ્ઞાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. આજે તમારું મન એફીસ ના કામ માં નહિ લાગે? આજ તમારા મન માં કોઈ દુવિયા હશે જે તમને એકાગ્ર નહિ થવા દે. આજે તમે તમારા પ્રેમી સાથે સમય પસાર કરી શકશો અને તમારી ભાવનાઓ ને તેની સામે રાખી શકશો. આજે તમારા

જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડો, વૃશ્ચિક - જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નર્ભાળ ખુશી તથા મોજમજા. ઝડપથી નાલાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના પરાવશા. પારવારના સત્યાના જરૂરાયાતાન પ્રાથામકતા આપજી. તમના સુખ-દુ:ખમાં સહબાગી થાવ જેવી તેમને અનુભી થાય કે તમને તેમની પરવા છે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આપ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજશે. જેવીનને તથાત મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા માનોજે જ પ્રોજેક્ટમાં અનેક લોકોને સોકળો, તમારા વડે આજ ના દિવસ માં એવા કામ કરવા માં આવશે જેના હિએ એ છતા કરા સ્થાન એ હોય દેવા આ પ્રાથમિક વિષે તમે ઘણી વાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા. તમારા જીવનસાથી તમને પ્રેમના અતિઆનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચક્તિ કરી દાવાના મિજાજમાં છે, તેમને મદદરૂપ થાવ.

ધન - લાંબી મુસાફરી ટાળજો કેમ કે મુસાફરી માટે તમે ખૂબ નબળા છો. તમારી બચતને તમે રહ્યાં તો કાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમને રાજકોટ કોંગ્રેસના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ

પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો નવા પ્રૉજેક્ટ અને ભવિષ પર ધકેલી દો. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

મકર - તમારી અંદર આજે ઉર્જા જોઈ શકાય છે. તમારું આરોગ્ય સંપર્ણપણે તમારો સાથ આપશે. આજે તમે તમારા ઘર ના સભ્યો ને ક્યાંક કરવા માટે તમારો સાથ આપશે. આજે તમે તમારા ઘર ના સભ્યો ને ક્યાંક કરવા માટે લયી જાયી શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થયી શકે છે. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે. કામના સ્થળે આજે કોઈક વ્યક્તિ તમારી સાથે કંઈક સારૂં વર્તન કરશે. જેઓ ઘર ની બહાર રહે છે આજે તે તેમના બધા કાર્ય પૂર્ણ કર્યા પછી, સાંજે ઉદ્યાન માં અથવા એકાંત સ્થળે સમય વિતાવવા નું પસંદ કરશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની

પતાડ કરતા. આજના દિવસ તૈયાસ પારશાત જીવનાના શ્રહાન દિવસ જેના રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે. કુંબ – આજે તમારું આરોગ્ય સ્વસ્થ રહેવા ની અપેક્ષા છે. પોતાના સારા સ્વાસ્થ્ય ના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમત ની યોજના બનાવી શકો સ્તાસ્ત્ર યા લાય તેમ બાજ ભાગ તાલ સ્તારાગતા યા યાજાયા પાતા છો? લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા યુ-યુએલ કંડમાં રોકાણ કરો. તમારા તરસ્થી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. વધારે પડતા કામ છતાંય ાઇવત છે, તમારા પ્રત્યને કાઈ ખેલાને પાંચ કરો શકે. વધારે પશા કાન છતાય કાર્યક્ષેત્ર માં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે. તમે આપેલા કામ ને સમય સીમા પહેલાજ પૂર્ણ કરી લેશો? તમારામાંના કેટલાક આજે લાંબી મુસાકરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી આજ તમને વખાણશે, તમારા વિશે સારી વાત કરશે અને તમારા પ્રેમમ

સરવા વડવા. મીન - આલ્કોહૉલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. આજે પાર્ટી માં તમારી મુલાકાત કોઈ એવા માણસ થી થયી શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. તમારો વિનોદી સ્વભાવ તમારી માસપાસને વાતાવરણ ઝળકાવશે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન

પહોંચો ત્યાં સુધી તમારો હેતું છતો ન કરો. આજે તમારી પાસે મક્ત સમય હશે અને તમે આ સમય નો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો. આજે તમને માનસિક શાંતિ નો અનુભવ થશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

## ્રી BHRIRAM City MONEY WHEN YOU NEED IT MOST માંગાન્સ લીમીટેડ

#### સાંકેતિક કબજા નોટીસ

સાંકેલિક કળજા નો ટીસ જત જાશાવવાનું કે નીચે સહી કરનાર શ્રીરામ સિદી ચુનિયન ક્રમ્ચનાન્ય હીમીરેંદ (એસમીચુએક) ના અધિકૃત અધિકારીએ સિક્સોરીટાઇઝેંગન અને રિકન્સટ્ટલન ઓક કાંચનાન્યિવા એરેટ્સ અને એન્કોરોમેન્ટ ઓફ ક્રિક્સોરીટીઇન્ટરેસ્ટ એક. 2000 (જાયોલ કાંચકા) નો જોગ્યાદાઓ હેઠળ અને સિક્સોરીટીઇન્ટરરેસ્ટ (એન્ફોરોમેન્ટ) નિયમો, ૨૦૦૨ (જાયાલેલ નિયમો) ના નિયમ ર સાથે વંચાવી ૧૩ (૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે કોપ્ટલમાં જાયોવેલ દ્વારારોને મોગણા નોટીસ જારી કરી જણાવેલ મોગણા નોટીસમાં જાયોવેલ ક્રમ ચુક્લવા જાયાદાર્યું હતું. દેવાદારોને કરમની પત્ત ચુકલાથી કરવામાં આવે છે કે નીચે સહી કરનાર આધિકૃત જાહેર જનાતાને આથી જાય કરવામાં આવે છે કે નીચે સહી કરનાર આધિકૃત જાહેર જનાતાને આથી જાય કરવામાં આવે છે કે નીચે સહી કરનાર આધિકૃત ક્રમારી સ્ટાપાર્યાલ નિયમના નિયમ ર સાથે લોચી કરવા સ્ટાપાર્યાલ સિલકતાનો સોલિક કળને રૂ એક્રીલ, ૨૦૦૨ ના રેજ લઇ શિલો છે. આથી ખાસ કરીને દેવાદાર અને જાહેર જનતાને મિલકત સાથે હોઇ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો એક કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઇપણ સોદો ઓક્ર અને તેના પ્રવાલ વ્યાપના માર્ગને આધિન રહેશે.

દેવાદારનું નામ અને સરનામું	માંગણા નોટીસ	મિલકતની વિગત
૧) મેઘા પાર્સલ સર્વિસ	રૂા. ૧૯,૦૧,૧૦૨/–	રેસીડેન્સીયલ કલેટ નં.
(પ્રોપ– ગૌરીશંકર એચ મંત્રી)	(3પિયા ઓગણીસ લાખ	૩૦૫, ક્ષેત્રફળ અંદાજીત
પ્લોટ નં. ૯૦૩, ફેઝ-૪,	એક હજાર એક્સો બે	૧૧૨૫.૦૦ ચો.કૂટ, ત્રીજો
જીઆઇડીસી વાપી-	પુરા)	માળ, પંચરત્ન કો.ઓપ.
365964.	નોટીસ તારીખ	હાઉસિંગ સોસાચટી
૨) ગૌરીશંકર એચ મંત્રી	95.90.55	લીમીટેડ તરીકે જાણીતી
બી/૩૦૫, પંચરતા		બિલ્ડીંગમાં, સર્વે ન <u>ં</u> .
કો.ઓપ.હાઉસિંગ	એગ્રીમેન્ટ નં.	૩૭૮/૨/એની એનએ
સોસાથટી, વાપી દમણ રોડ,	CDVPITF1503260001	જમીન પર બંધારોલ મુકામ
સર્વે નં. ૩૭૮/૨એ, ચલા,		ચલા,તાલુકોપાલકી,જિલો
વાપી-૩૯૬૧૯૫		વલસાડ, ખાતેની
૩) મુજ્ઞિદેવી જી. મંત્રી		ગૌરીશંકર હરીસંદ મંત્રીની
બી/૩૦૫, પંચરતા		માલિકની મિલકતના
કો.ઓપ.હાઉસિંગ		તમામ ભાગ અને હિસ્સાં.
સોસાયટી, વાપી દમણ રોડ,		અન ાહસ્સા.
સર્વે નં. ૩૭૮/૨એ, ચલા,		
વાપી-૩૯૬૧૯૫		
૧) કેમી લેઇર ટેક્સ પ્રાઇવેટ	રૂા. દ્,પ૨,૪૩૦/-	પ્લોટ નં.૧૮ (સર્વે નં.
લીમીટેડ (ડાયરેક્ટર–	(રૂપિયા છ લાખ બાવન	૧૨૧/પૈકી) શિલ્લાસા
તારનાથ બાબુરાવ	હજાર ચારસો ત્રીસ પુરા)	ઇન્ડસ્ટીયલ કો.
નાચકપોપકર)	નોટીસ તારીખ	ઓપરેટીવ સોસાયટી,
પ્લોટ નં. ૧૮, સર્વે નં.	95.09.35	ગામ અમલી, દાદરા અને
૧૨૧/પૈકી, સિલ્વાસા	સ્ટ.બ્ય.સ્ટ એગ્રીમેન્ટ નં.	નગર હવેલી કેન્દ્રશાસિત
ઇન્ડ.કો.ઓપ. સોસાયટી		પ્રદેશ ખાતેની ઇન્ડસ્ટ્રીચલ
લીમીટેક, સિલ્વાસા–	CDVPITF1410040001	હેતુસરની બિન
368630		ખેતીલાચક જમીન તેમજ
૨) તારાનાથ બાળુરાવ		ફેક્ટરી/શેડ અનેતે ના પર
નાચકપોપકર		બંધાચેલ બિલ્ડીંગ બી,
શ્રેચસ બિલ્કીંગ, ફ્લેટ નં.		ક્ષેત્રફળ ૧૬૭.૫૫ ચો.મી.,
૪૧૦, પ્લોટ નં. ૨૧, સેક્ટર-		અને તેની સાથે સંકળાચેલ
૧૭, કીબીસી, વાશી–		તમામ હકો, ટાઇટલો અને
800003		હિત.
3) સમીર તારકનાથ નાયક		
૪૧૦, પ્લોટ નં. ૨૧, સેક્ટર-		
૧૭, કીબીસી, વાશી–		
૪૦૦૭૦૩ ૧) મેસર્સ સર્વદેવ એસ		એન.એ પ્લોટ નં. ૫,
	રૂા. ૬૯,૩૯,૭૨૬/– (૩પિયા ઓગણસીત્તેર	એન.એ પ્લાટ ન. ૫, ક્ષેત્રકળ ૩૪૫.૫૦ ચો.મી
જરારવાલ	(રૂપયા આગણસાત્તર લાખ ઓગાયચાલીસ	
(પ્રોપરાચર સર્વદેવ શ્રીનાથ	લાખ આગણચાલાસ હજાર સાતસો છવ્વીસ	તેમજતેના પરનું બંગલાનું બાંધકામ ધરાવતી રેવન્યુ
જ્યસ્વાલ)		બાઇકામ ધરાવતા રવન્યુ સર્વે નં. સ્વ3./વની મકામ
નાઝબાઇ રોક,	પુરા) નોટીસ તારીખ	સંઘ ન. ૨૧૩./૧ના મુકામ ચલા, તાલકો પારડી, જિલો
વાપી-૩૯૬૧૯૧, તાલુકો	અદાસ તારાખ ૨૯.૦૧.૨૨	ચલા, તાલુકા પારડા, ાજારા વલસાડ ખાતેની
પારડી, જિલો વલસાડ.	રહ.ઠવ.૨૨ એગ્રીમેન્ટ નં.	વલસાડ ખાતના મિલકતના તમામ ભાગ
0. 0.	CDVPITF2101200002	
ર. સર્વદેવ શ્રીનાથ જયસ્વાલ	ODVF11F2101200002	છળ હિસ્સા. થેલુ–સામા: ઉત્તર: ખલી જમીન
મમતા સોસાચટી, ચલા,		દક્ષિણ: અંદરનો રોડ,
વાપી-૩૯૬૧૯૧, તાલુકો		પુર્વ: પ્લોટ નં દ્
પારડી, જિલો વલસાડ		પુધ:પ્લાટન ફ પક્ષિમ: પ્લોટ નં. ૪
3. શૈલેષ એસ જ્યસ્વાલ		

વા માટે ઉપલબ્ધ સમ

૧૩ ની પેટા કલમ (૮) ની જોગવાઇઓ પ્રત્યે દેવાદારોનું ધ્યાન દોરવામાં આવે છે શ્રીરામ સિટી ચુનિર

ાળંદામાં એક્ટની કલ

#### દ્વારકામાં નરાધમે સતત ત્રણ માસ સુધી વારંવાર દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવતાં ચકચાર



અમદાવાદ, ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ

મહાનગરપાલિકાના પૂર્વનેતા વશરામભાઈસાગૃઠિયા કોંગ્રેસમાંથી

રાજીનામું આપીને આમ આદમી

રાહું માસા ગાર માઇ ત પાર્ટીમાં જોડાયા છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં

વશરામભાઇ આમ આદમાં પાટામાં જોડાવા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બંગ્રે નેતાઓ નો સંપર્ક કરી અને તેમને સમજાવવામાં આવ્યા હતા.ઈન્દ્રનીલ ગઈ કાલે દિલ્હીમાં હતાં. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ

સાથે મીટિંગ કરી હતી. આમ આદમી

પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્લી અને પંજાબમાં જીત મેળવી

પરવાર કર્ય છે. પજાબમાં જીત બાદ

ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું

અને રાજકોટના

રાજયગર

જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાંથી વધુ એક શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં દ્વારક તાલુકાના એક ગામમાં એક નરાધમે સગીરા સાથે સતત

પરાવન તેમારા તાલ તેતત ગુભ માસ મુખી અનેક વખત દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી થઇ જતા આરોપીનું ફૂત્ય સામે આવ્યું છે. તેથીને રાગ્યી-મકાલી આરોપીએ અનેકવાર દુષ્કર્મ આચ્યું હોવાનું ફરિયાદમાં જ્રહેર થયું છે. પોલીસે ફરિયાદના આપારે આરોપીને પકડવા કાર્યવાહી શરૂ કરી છે, દેવભામિ દ્વારાય જિલ્લાના તરાગ તાલ્યાના પેત શરૂ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના એ: ગામમાં એક સામાન્ય પરિવારની સગીરવયની દીકરી પર દષ્ક્રમ ળાનમાં એક સામાપ્ય પારધારમાં તમારવધમાં ઠાકરા પર હુંજીન આચરવામાં આવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સીદીયાભા રાણાભા સુમણીયા નામના શખ્સે આજથી ત્રણ માસ પૂર્વે ગામના જ એક પરિવારની સગીર વયની દીકરીની એકલતાનો પૂર્વ ખાત્યા કે અંક સારવારના સાર વર્યના ઠાકરાના અકલાતાન લાભ લઇ તેણીને ડરાવી-ધમકાવી તેણીની મરજી વિરૃદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો . ત્યારથી આ શખ્સે તેણીને અવારનવાર ધાકધમકીઓ આપી, છેલ્લા ત્રણ માસના ગાળામાં અનેક વખત દુષ્કર્મ ગુજાર્યા હતા. નરાધમના અવારનવારના દુષ્કર્મને લઈને સગીરા ગર્ભવતી બની ગઈ હતી. જેને લઈને તેશી સતત ગુમસુમ્ રહેવા લાગી હતી. પોતાના પરના શારીરિક અત્યાચાર તો છુપાવ શકાય પણ ગર્ભકાળ કેમ સંતાડી શકાય પણ ગર્ભકાળ કેમ દિવસ તેણીએ તેના પરિવારને જાણ કરી હતી. જેને લઈને પરિવારજનોએ દ્વારકા પોલીસનો સંપર્ક કરી આરોપી સામે પારવારજનાએ દ્વારકા પાલાસના સપક કરા આરાપા સામ આઈપીસી કલામ (અને ૨૦૧૮ના નવા સુધારાની કલામ) ૩૦૬, ૩૦૬(એન), ૩૦૬(૩), ૩૦૬ ડીએ, પ૦૬(૨) તથા પોકસો એક્ટ સને ૨૦૧૨ની કલામ ૪, ૬, ૧૦ મુજબ કરિયાદ નોંધાવી હતી. આ ગંભીર ગુનાને લઈને પોલીસ તુરેત સહિય થઇ ગઈ હતી અને તાત્કાલિક આરોપીને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી

જોડાય એવું ઈચ્છું છું. ભાજપ ગુજરાતને ગમતું નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે.મને વિચાર ગમ્યો એટલે હું જોડાયો છું. આજકાલ રાજકિય સ્થિતિ છે કે શું સોદા થયા એવું છે. હું સોદાનો માણસ નથી.ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવી નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જોઈએ એ કોંગ્રેસમાં છે નહીં એટલે આપમાં જોડાયા છીએ. હું પાર્ટી જે નક્કી કરે એમ ચૂંટણી લડીશ.હું લડવા કરતા પાર્ટીને ઉપયોગી થાઉ પરંતુ અગત્યતા ચૂંટણી લડવાની નહીં.

સાગઠિયા આપમાં જોડાયા, પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરાયું

અભિયાન શરૂ કર્યું છે. જે ગુજરાતમાં દેખાતું નથી. એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં આમ આદમી

માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને

સરકાર બને તેનાથી પ્રભાવિત થયો હતો. મારુ જાહેર જીવન હમેશા લોકો

માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો ભાજપ

સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ

મારી દ્રષ્ટિએ લાંછન છે.હું હમેશા લોકો

માટે મારો સમય આપવો છે. લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતા

કોંગ્રેસ સારો પક્ષ હતો અને આમ આદમી

પાર્ટી લાગે છે માટે આપમાં જોડાયં

યાટા લાગ છે માટ આપમાં જાડાયા છું.આગામી દિવસો આમ આદમી પાર્ટીનાછે. પ્રાઇવેટ હોસ્પિટલને ડોકટરો

મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો

કેમ ન મળે. હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો

મારામાં વિશ્વાસ રાખતા હોય અને

નીડર ઉભા રહેવાનો માનસિક અનુ કર્યો હોય તેઓ સૌ આમ આદર્મ

તા તા તહા. કોંગ્રેગમાં માગે ત્યક્તિગત વાંધો ન હતો. કોંગ્રેસમાં આયોજનની ક્ષમતા છે.નરેશ પટેલ મારા મિત્ર છે. કોંગ્રેસમાં જોડાવવાના છે મને ખબર નથી. નરેશ પટેલ હોય ત્યાં મારુ કદ વધે પણ ઘટે નહિ. કોઈપણ સમાજના સારું ઈચ્છતા વ્યક્તિ જોડાતા હોય અને એમને લાગે તો જોડાય જાય. રાજકોટમાં અમારા કામને જોઈબે વાર

અપવા અને જાડાવવા ભકાવ કર્યો .શિક્ષણ નીતિ અને આરોગ્ય અંગેની માહિતી મેળવી. ગામડાની સ્કૂલો પણ જોઈ છે.એમના વિચારો રાષ્ટ્રવાદી છે. પંજાબમાં જે ઠરાવ એમને કરાવ્યો છે. ડો. બાબાસાહેબ અને ભગતસિંહની તસ્વીરનો આનંદ થયો છે.બંધારણ સાચવવું હોય તો તમામ ગુજરાતમાં દલિતોને જણાવુ છું કે આમ આદમી પાર્ટીમાં જોડાવો.ગુજરાતના આઠમાં પાટામાં જાડાવા, ગુજરાતમાં ભુષ્યમંત્રી કહેતા હોય કે ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પોલીસ ખાતું અને બીજા નંબરે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે. જે શરમજનક છે. હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદયીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઉભા રહેવાને રાખતા હાવ અને નાડર હતા રહવાના માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જોડાય એવું ઈચ્છું છું.

આપ લડી અને બીજા નંબરે રહી છે.કાલે કેજરીવાલજીને મળ્યા અને

આપમાં અમે જોડાવવા નિર્ણય

# આલોક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

3૧ માર્ચ,૨૦૨૨ ના રોજ પુરા થયેલા વર્ષ માટેના કન્સોલીડેટેડ ઓડીટેડ નાણંકીય પરિણામો

		(₹ કરોકમાં, શેર દીઠ કેટા સિવાય)				
용 이 .	વીગતો	વર્ષના અંતે ૩૧.૦૩.૨૦૨૨	वर्षना संते 39.03.२०२१			
٩	ઓપરેશન્સમાંથી આવક	#306.40	3,280.46			
5	સમચગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન)(કર અને અપવાદરૂપ વસ્તુ પહેલા)	(506.85)	(પદ્દર.૧૮)			
3	સમચગાળા માટે ચોપ્ખો નફો / (નુકસાન)કર પહેલા (અપવાદરૂપ વસ્તુ પછી)*	(506.85)	(8,848.83)			
8	સમયગાળા માટે યોખ્ખો નફો / (નુકસાન) કર પછી (અપવાદરૂપ વસ્તુ પછી)	(02.509)	(4,503.32)			
ų	કર પછી સમયગાળા માટે કુલ વ્યાપક આવક	(૨૫૦.૫૫)	(૫,૬૨૪.૨૮)			
8	ચૂકવેલ ઇકિવટી શેર મૂડી, ઇકિવટી શેર્સ ₹ ૧/- દીઠ ફેસ મુલ્થ	805,43	¥61,43			
0	પુનઃ મૂલ્યાંકન અનામત સિવાય અન્ય ઇકિવરી * *	(85.803.68)	(१८,१४३.२८)			
6	ર્શકિવટી શેરદ્રીઠ કમાણી (ઇપીએસ)					
ll	(₹ ૧/− દીઠ ફેસ મુલ્ય) (વાર્ષિક લથી):					
ll	અપવાદરૂપ વસ્તુ પછી મૂલભૂત (₹ માં)	(98.0)	(१५.१६)			
ll	अपवादश्य वस्तु परेवा मूलभूत (र मां)	(98.0)	(8.88)			
ll	અપવાદરૂપ વસ્તુ પછી મંદ /સીમિકૃત (₹ માં)	(98.0)	(१५.१६)			
	અપવાદરૂપ વસ્તુ પહેલા મંદ /સૌમિકૃત (₹ માં)	(98.0)	(8.6.8)			
. 0.	* Gue Griße com mobred					

2)	આડાટક સ્ટન્ડ અલાગ ગાણાકાય પારણામાં પર વધારાગામાહિતા ગાય મુજબ છ		
			(₹ કરોડમાં)
54	વીગતો	વર્ષના અંતે	વર્ષના અંતે
٠i.		39.03.2022	39.03.2029
٩	ઓપરેશન્સમાંથી આવક	૭,૧૫૦.૯૧	3,034.39
5	સમચગાળા માટે ચોખ્ખો નફો / (નુકસાન) (કર અને અપવાદરૂપ વસ્તુ પહેલા)	(968.96)	(9,960.06)
3	કર પછી ચોખ્બો નફો / (નુકસાન) (અપવાદરૂપ વસ્તુ પછી)	(968.96)	(4,648.00)
×	સમચગાળા માટે કુલ વ્યાપક આવક (કર પછી)	(968.86)	(4,642.98)

વાપી–૩૯૬૧૯૧, તાલુકો પારડી, જિલો વલસ સિક્યોર્ડ એસેટ પરત મેળવ